



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૫/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૧૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૧૯૫ લીટર દેશી દારૂ, ૨૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૭૬ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૭૭ બિયર ટીન અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧૦ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૨૪,૨૧૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૨૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૨૧/૧૯

ગોમતીપુર: સતીશભાઈ નૈનેશભાઈ કાપડીયા (ઉ.વ.૨૮) (રહે.સત્યમ ફ્લેટ રાયપુર મીલ પાસે ગોમતીપુર) એ તા.૨૯/૫/૧૯ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આજથી પાંચેક મહિનાથી તા.૨૮/૦૫/૧૯ નારોજ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી આયશાબહેન (જેના પુરા નામઠામની ખબર નથી) એ બાપુનગર સ્ટેટ બેંક પાસે તથા ગાંધીનગર પથીકા આશ્રમ ખાતે સતીશભાઈ કાપડીયા તથા સાહેબોને લોન કરાવી આપવા બાબતે દરેક સભ્યના રૂપિયા ૧૦,૦૦૦/- લેખે કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦/- લઈ ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે બોલાવી લોન નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આઇ.રઈસ ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૯૨૨/૧૯

વેજલપુર: મોહમદફૈઝાન મોહમદઅયાઝ શેખ (રહે. સિલીકોન વેલી આઝાદપાર્ક ટોરેન્ટ પાવર પાછળ સોનલ રોડ વેજલપુર) એ તા.૨૯/૫/૧૯ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૫/૧૯ રાતના ૧૧/૩૦ થી તા.૨૮/૦૫/૧૯ સાંજના ૭/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ધરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, કાંડા ઘડીયાળ અને રોકડ રૂપિયા ૭૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૩,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.દેવડા ચલાવે છે.

ચાંદખેડા: ભૌમીક આશીતભાઈ દેસાઈ (રહે. સેતુ એમરાલ્ડ મણીલાલ પાર્ટી પ્લોટ સામે મોટેરા ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૫/૧૯ કલાક ૧૧/૦૦ થી તા.૨૯/૫/૧૯ કલાક ૯/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૪૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ચૌધરી ચલાવે છે.

કાલુપુર: મુર્તજા અસગરઅલી પુલાવવાલા (રહે. ઝકરીયા પોળ ઝકરીયા મસ્જીદ પાસે રીલીફ રોડ) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૫/૧૯ કલાક ૫/૪૫ વાગ્યાના સુમારે અજાણી વ્યક્તિ પોતાના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી દાગીના કિંમત રૂપિયા ૮૫,૦૦૦/-, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૮૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૯,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એચ.મછાર ચલાવે છે.

લુંટ:-

સમાચાર યાદી નં.૯૨૩/૧૯

સોલા હાઈકોર્ટ: કાન્તાબહેન વા/ઓ શિવભારથી ગૌસ્વામી (ઉ.વ.૫૦) (રહે.શિવલાય એપાર્ટમેન્ટ સાલપરા રોડ વેજલપુર ગામની પાછળ વેજલપુર) એ તા.૨૯/૫/૧૯ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૫/૧૯ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે ગોતા હાઉસીંગમાં અંબીકાનગર ચોક ગોતા ખાતે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ કાન્તાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-ખેચી તોડી લુંટ કરી નાસી ગયા હતા.આ ગુનાની તપાસ પોસઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે

ચોરી:-

સમાચાર યાદી નં.૯૨૪/૧૯

રાણીપ: ગોપાલસિંગ ભીખસિંગ ચૌહાણ (ઉ.વ.૩૯) (રહે.ગામ ભાયરના તા.લુણી જી.જોધપુર રાજસ્થાન) એ તા.૨૯/૫/૧૯ નારોજ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે લકઝરી બસ નંબર આરજે ૭ પીએ ૭૩૯૪ માં ડ્રાઇવર તરીકે નોકરી કરતો આરોપી કમલેશ રામચંદ્ર નાચી (રહે. ગામ જેતાયાવાસ તાલુકો-બિલાડા જી-જોધપુર રાજસ્થાન) તા.૨૭/૦૫/૧૯ કલાક ૯/૧૫ વાગ્યાના સુમારે સુભાષબ્રિજ પ્રબોધ રાવળ સર્કલની બાજુમાં ખુલ્લા મેદાનમાંથી લકઝરી બસ નંબર આરજે ૭ પીએ ૭૩૯૪ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જી.દેસાઈ ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૯૨૫/૧૯

નરોડા: નરોડા નાના ચિલોડા મેઘા હાઇટ્સ નામની સાઇડ “બી” બ્લોક ખાતે રહેતા અને ત્યા જ કામ કરતા પોપટલાલ ભીમજીભાઈ ખરાડી (ઉ.વ.૨૧) (મુળ વતન. ભેંસરા ચોકડા તા-ગલીયાગોટ જી-ડુંગરપુર રાજસ્થાન) તા.૨૮/૫/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે સાઈટના ચોથા માળેથી પડી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી સુરેશ સખારામ ચલાવે છે.

આનંદનગર: દિપકભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ.૩૦) (રહે. રોહિતવાસ જોધપુર ગામ સેટેલાઈટ) એ તા.૨૯/૦૫/૧૯ કલાક ૧/૦૦ થી ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મુનીરમહંમદ ઇસુબભાઈ ચલાવે છે.

રામોલ: અલ્પેશભાઈ નરસિંહભાઈ પટેલ (ઉ.વ.૩૪) (રહે.વ્રજવિહાર સોસાયટી વસ્ત્રાલ) એ બિમારીથી કંટાળી તા.૧૮/૫/૧૯ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે ધાબા પરથી પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રાધાબહેન ચંદુભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.